https://archive.org/details/bk039/page/n0/mode/1up

1968-01-20 -Puchela Prashno -Gopal Somji Bhagat (39)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

॥ ૐ નમો ભગવતે વાસુદેવાય ॥

"એક સત્ય ઘટના"

ના

લેખકને

સજ્જડ જવાબ

સાથે

પૂછેલા પ્રશ્નો

સંવત ૨૦૨૪ ઇ. સ. ૧૯૬૮

લેખક અને પ્રકાશક

પટેલ ગોપાલજી સોમજી ભગત

ગામ કચ્છ શ્રી રવાપુરવાળા

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk039/page/n1/mode/1up

Real Patidar
Unravel Truth

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 3, 4, 5, 6, 7, 8, 9, 12, 13, 14, 15, 16.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format
References by: RealPatidar.com

https://archive.org/details/bk039/page/n2/mode/1up

1968-01-20 -Puchela Prashno -Gopal Somji Bhagat (39)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.05 15:19:33 +05'30'

realpatidar.com

|| ૐ નમો ભગવતે વાસુદેવાય ||

“એક સત્ય ઘટના”

ના

લેખકને

સજ્જડ જવાબ

સાથે

પૂછેલા પ્રશ્નો

સંવત ૨૦૨૪ ઇ. સ. ૧૯૬૮

લેખક અને પ્રકાશક

પટેલ ગોપાલજી સોમજી ભગત

ગામ કચ્છ શ્રી રવાપુરવાળા

realpatidar.com

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk039/page/n4/mode/1up

realpatidar.com

"એક સત્ય ઘટના" ના લેખકને સજ્જડ જવાબ સાથે પૂછેલા પ્રશ્નો

"એક સત્ય ઘટના" એ નામે પ્રગટ થએલ પુસ્તક તા. ૫–૧૨–૬૭ ના રોજે ગામ શ્રી નખત્રાણા મધ્યે શ્રી નથુભાઇ નાનજીભાઇ પટેલ પાસેથી વાંચવા મને સદભાગ્ય સાંપડયું, એ પુસ્તકમાં લખાણની તારીખ ૨૫–૮–૧૯૬૭ છે અને છપાઇની તા. ૨૫–૯–૧૯૬૭ છે. અને લખાયું છપાયું તે હિંમતનગરમાં; જીલ્લો સાબરકાંઠા, લેખક : "અંતરઆત્મા", અને નિમિત્ત : રવજીભાઇ કાનજીભાઇ પટેલ.

ભાઇશ્રી આ પુસ્તક લખવામાં તમોએ જે તસ્દી લીધી છે, તે તસ્દી લેવાનો મુળ ઉદ્દેશ તમોએ પીરાણાપથંને પ્રોત્સાહન આપવા માટેજ હોય એમ અમોને જણાય છે.

ભાઇશ્રી પીરાણાપંથના સ્થાપક પીર ઈમામશાહે કેટલાક હિંદુધર્મના દેવોની નીંદા કરી ભેળસેળીઓ ન હિંદુ ન મુસલમાન એવો પીરાણા સતપંથ ધર્મ આજથી લગભગ પાંચસો વર્ષ ઉપરે ચાલુ કરી હજારો ભોળા, અભણ અને અજ્ઞાનીજનોને પોતાની ઇન્દ્રજાળમાં ફસાવી ત્રિશંકુની માફક અધ્ધર લટકતા કર્યા હોય એમ તેમના ઇતિહાસ પરથી જણાય છે.

ભાઇશ્રી અમોએ સાંભળ્યું છે કે શ્રી રવજીભાઇ એક મહાવિદ્વાન અને ચાલાક પુરૂષ છે. અમોએ તમોને વ્યકિતગત જાણ્યા તેમજ જોયા નથી. તમો જો તેવા વિદ્વાન અને ચાલાક હશો તો અમારે ગૌરવ લેવા જેવું છે જે અમારી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં આવા ચાલાક અને વિદ્વાનભાઇઓ છે. પણ ભાઇશ્રી તમારી અત્યારની ચાલાકીના ચક્રોએ તમોને કઈ દિશામાં ચકડોળે ચડાવેલા છે? હાલના જમાનાના રંગરાગ અને સુધરેલા પવનની પતાકાઓ કઇ દિશામાં ફરકી રહી છે, તેનો ખ્યાલ કરવા તમોને જરા પણ વખત મળ્યો હોય એમ અમોને જણાતું નથી.

ભાઇશ્રી આપણે ભણ્યા હોઇએ તો આપણા ભણતરને જરા ગણતરના રૂપમાં ફેરવમાં શીખવું જોઇએ. જે હું પોતે કોણ છું? કઇ જ્ઞાતિમાં મારો જન્મ થયો છે? મારો સનાતન આર્ય હિંદુધર્મ શું છે? અને હાલમાં હું કયા રસ્તે જઇ રહ્યો છું? તેનો ખ્યાલ તમો પોતાનું હૈયું હાથ કરી પોતામાં રહેલા આત્મામાં કરો જે પીરાણા ધર્મના સ્થાપક કોણ છે? આ સૃષ્ટિની શરૂઆતથી ઋષિમુનીઓ કે પાછળથી પ્રગટેલા ઇમામશાહ?

ભાઇશ્રી આપણા ભારત વર્ષમાં યુગાન્તરથી ચાલતો આવતો એવો જે શુદ્ધ સનાતન હિંદુધર્મ જેની શરૂઆત આ સૃષ્ટિના કર્તા બ્રહ્મા પછી મહાન ઋષિમુનીઓ, બ્રાહ્મણો તેમજ સનાતન હિંદુધર્મના ધર્માચાર્યો કે જેમણે પોતાના અસલ સનાતન હિંદુધર્મને જીવતો-જાગતો રાખવા માટે આજ દીન પર્યંત તનતોડ મહેનત કરી જાળવી રાખ્યો એવો જે સનાતન હિંદુ ધર્મ તેમને હિંદુઓએ ટકાવી રાખવા માટે વખત આવ્યે પોતાના તન, મન, અને ધનનાં બલીદાનો આપવામાં આજ દીવસ સુધી પાછી પાની કરી નથી તેજ સાચા

realpatidar.com

https://archive.org/details/bk039/page/n5/mode/1up

realpatidar.com

હિંદુ છે અને હિંદુ તરીકે તેનેજ ગણુવામાં આવે છે. એવા જે પુર્વના તથા અત્યારના હિંદુઓ કે જેઓ ભૂળકાળે વિધર્મીઓની સત્તાનો ભોગ બનતાં કેટલાંક નબળા મનના હિંદુઓને ન છૂટકે વિધર્મીઓને વશ થવું પડયું હતું છતાં પણ પોતાના અસલ હિંદુધર્મને ભુલી ગયા ન હતા એટલે વખત આવે પોતાના અસલ ધર્મમાં પાછા આવી ગયા. તેમાં જેઓ ભોળા અભણ, અને અજ્ઞાની હિંદુઓ હતા તેમના ભોળપણાનો લાભ લઇ સૈયદ ઇમામ શાહે પોતાની પ્રપંચી પીરાઇનાં કપટી પુષ્પોની માળાઓ ગુંથી તે વખતના કેટલાક ભોળા કણુબીઓના ભોળા આગેવાનો તેમજ બીજાઓનાં ગળામાં નાખી પોતે રચેલી કપટરૂપી ઇન્દ્રજાળમાં ફસાવી પોતે રચેલો ન હિંદુ ન મુસલમાન એવા કલ્પીત ધર્મનો ઘંટ ગળે બંધાવી ગુજરાતમાં પોતાના સ્વજ્ઞાતિ બંધુઓથી હડછૂત કરાવી વિલે મોઢે કચ્છમાં વિદાય કર્યા એમ તેમનો ઇતિહાસ જોતાં જણુાય છે. તો તેવા કલ્પીત ધર્મના ઘંટના અવાજે કાનના પડદા તોડી નાખી બહેરા બનાવી દીધા હોય તેવી રીતે કોઈનું સાંભળવા પણ તમો તૈયાર થયાજ નહિ એમ એ લખાણુ ઉપરથી અનુમાન થાય છે. જે મનુષ્ય પોતાને ઉપરથી હિંદુ અને અંદરથી આચારે વિચારે મુસલમાન એવું જગતને બતાવી નાટક કરતો હોય તો તેના છુપા છળથી જગત ક્યાં સુધી અંધારામાં રહેશે કે જ્યાં સુધી જાણુનારને સામાન છળ કપટનું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી.

ભાઇશ્રી અમો તમોને પૂછવાની રજા માગીએ છીએ કે તમો જો થોડું અગર વધારે ભણ્યા હો તો એટલું જાણુતાં જરૂર શીખો કે આપણા પુર્વજો આજથી લગભગ પાંચસો વર્ષ પૂર્વે પીરાણા સતપંથી હતા કે સનાતની? જો તમારા પુર્વજો સનાતની હતા એમ જો તમોને જણુાય તો તમો પણ સનાતનીજ છો એમ તમારે ન છૂટકે માનવુંજ પડશે અને કદાચ જો તમોને ન સમજાય તો તમારા કુશેની બ્રાહ્મણોનેજ પૂછી જોશો કે બાવા ઇમામશાહ આજથી કેટલા વર્ષ અગાઉ પ્રગટયા અને તેનો અર્ધ ઇમામી ધર્મ તેમણે ક્યારથી ચાલુ કર્યો? તો તમોને તેઓ પણ બતાવી આપશે એમ મારૂં માનવું છે.

ભાઇશ્રી તમો તમારી ચોપડીના બીજા પાનામાં લખો છો કે સનાતન ધર્મના આદર્શો શું છે? તેની શિખામણુ ત્યાં આવેલા સંત મહાત્માઓએ કે મુખ્ય મહેમાનોએ કોઇને ન આપી! ભાઇશ્રી તમારા કહેવા પ્રમાણે સનાતન ધર્મના આદર્શ મુજબ કોઇએ કોઇની પણ નીંદા કરવી નહિ એમ તમારૂં કહેવું છે. તો તે તમારી વાત બરાબર જ છે કે "કોઇની નીંદા કરવી તે સમાન પાપ નથી અને કોઇનું ભલું કરવુ તે સમાન પુણ્ય નથી" એમ દરેક ધર્મના સિદ્ધાંત છે, તેને કોઇપણુ ના પાડી શકતું નથી. પણુ નીંદા એટલે શું અને નીંદા કોને કહેવાય છે તે જો આપણુને બરાબર સમજાય નહિ તો આપણે એક બીજાઓનો દ્રોહ કરી બેસીએ એટલે ભાઇશ્રી નીંદા એટલે પોતાના અંગત સ્વાર્થને ખાતર જે બીજાઓનો દ્રોહ કરવો તેજ નીંદા કહેવાય છે. પણુ જનસમુદાયના હીતની ખાતર કદાચ એ શબ્દો વધઘટ કહેવા પડે તો તે નીંદા કહેવાતી હોય તો પણુ તે ધર્મરૂપમાં ફેરવાઇ જાય છે.

realpatidar.com

https://archive.org/details/bk039/page/n6/mode/1up

realpatidar.com

એમ સત્પુરૂષોનું કહેવું છે. અને તેવું કયારે કરવાની જરૂર પડે તો જ્યાં ધર્મનો લોપ થતો હોય તેવે સમયે ધર્મનું રક્ષણ કરવા માટે અગર જ્યાં મનુષ્ય જેવા ઉત્તમ દેહીનું વિધર્મીઓના હાથથી ભ્રષ્ટ થઇ તેના જાન માલનું નુકશાન થાતું હોય ત્યારે; ગૌ, બ્રાહ્મણ, પતિવ્રત્તા, વેદ, સાધુ તેમની નીંદા થતી હોય તેવે સમયે તેનું રક્ષણ કરવા ખાતર દરેકે દરેક મનુષ્યનો ધર્મ છે કે તેવે સમયે નીંદા કરીને પણ તેની રક્ષા કરવી. તેવા સમયની નીંદા તે ધર્મરૂપમાં ફેરવાઇ જાય છે એમ શાસ્ત્રકારો કહે છે. એમાં ખોટું લગાડવું તે બરાબર કહેવાય નહિ. સત્યને ખાતર મીઠાશનો ભોગ આપવો પડે તો તે આપીને પણ કડવું સત્ય સંભળાવવું જ પડે

ભાઇશ્રી તમારે એટલું તો જરૂર જાણવું જોઇએ કે જ્ઞાતિ અને ધર્મ એ બે ભિન્ન બાબતો છે. ધર્મ એક મનની માન્યતા છે ત્યારે જ્ઞાતિ એક સામાજીક બાબત છે. જુઓ? હિંદુ ધર્મમાં અનેક મતમત્તાંતરો છે. પણ તેવાં હિંદુ ધર્મના મતમત્તાંતરોએ પણ આજ દીવસ સુધી હિંદુઓનાં નિયમો, નામ અને આચરણોને પુરેપૂરાં જાળવી રાખ્યાં છે. ત્યારે પીરાણાપંથે તો હિંદુઓનાં નિયમો, નામ અને આચરણોને એક કોરે રાખી, પોતાનાં મનમુખી નિયમો, નામ, અને આચરણોને રાખી તેનું લાલન પાલન કરતા હોય તેમ જણાય છે. ઉપરાંત હિંદુઓનાં નિયમો, નામ અને આચરણરૂપી અંગોને તથા ગોર બ્રાહ્મણોને વિદાયગીરી આપી હોય તેમ પણ જણાય છે. જુઓ, હિંદુઓનાં નિયમો – વિષ્ણુ, શિવ, પાર્વતી. ગણપતિ અને સૂર્ય એ પાંચ દેવો પૂજ્યપણે માની દિનપ્રતિદિન તેમની પુજા કરવી તે. હવે નામ એટલે સનાતન એવા જે ભગવાન તેનું "ૐ નમો ભગવતે વાસુદેવાય" એ મંત્રોથી નામોચ્ચાર કરવો તે. અને આચરણ એટલે લગ્ન વખતે વેદીક રીતે હોમ હવન કરી વેદવિધિથી ચોરી ફેરા ફરવા તે. અને બીજું અંત સમયે મુડદાંને અગ્નિ સંસ્કાર કરવો તે. એ આદી હિંદુ ધર્મનાં અંગો છે તે ઉત્તમ એવા બ્રાહ્મણોથી વેદાનુસારે તેવા સંસ્કારો કરવા કરાવવા વગેરે જે નિયમો છે તેનું હિંદુ ધર્મ મુજબ દરેક રીતે પાલન કરવું તેનું નામ હિંદુ ધર્મ.

ભાઇશ્રી ઉપર જણાવેલ હિંદુ ધર્મના અંગોનું તમો પીરાણાપંથી ભાઇઓ કઇ રીતે પાલન કરો છો તે જણાવશો? પીરાણાપંથીઓમાં તે માંહેલા હિંદુ ધર્મના એકે અંગનું પાલન થતુ હોય તેમ અમોને જણાતું નથી.

Propaganda used to attract Satpanthis to Sanatan Samaj

ભાઇશ્રી તમોએ નખત્રાણા બોર્ડીંગ વિષે લખ્યું કે બોર્ડીંગમાં દરેક રીતે સહકારમાં સતપંથી ભાઇઓ તેમજ સનાતની ભાઇઓના સહકારથીજ બોર્ડીંગની સ્થાપના થઇ. તો તેના જવાબમાં જણાવવાનું કે ભાઇશ્રી તે તો આપણો એક સામાજીક પ્રશ્ન છે. બોર્ડીંગ એ એક આપણી સામાજીક મિલ્કત છે તેના સાથે કોઇના ધર્મને લાગતું વળગતું નથી. આપણે બહાર ગમે તેમ ઝગડા કરશું પણ આપણે આખરે ત્યાં ભેગા બેસીને સાથે જમવાનું છે.

realpatidar.com

realpatidar.com

એ તો આપણા સમાજનું વિશાળ ઘર છે જેમાં નાના મોટા દરેક જ્ઞાતિ બંધુઓનું સમાવેશ સ્થાન છે. જેનું સંચાલન આપણે હાલમાં તેમજ ભવિષ્યમાં પણ આપણે પોતાના અંગત રાગદ્વેશ તદ્દન ભુલી જઇને જ કરીએ છીએ અને કરવાનું છે. ભાઇશ્રી તમો લખો છો કે સુધારક સનાતની આગેવાન ભાઇઓની જીભમાં મીઠાશ અને હ્રદયમાં ઝેર એ પિચાશનાં લક્ષણો છે એમ જે જણાવો છો તો તેના જવાબમાં અમો તમોને પૃછવા માગીએ છીએ કે તમોએ તમારી ચોપડીમાં બેત્રણ ઠેકાણે પિચાશના લક્ષણ છે એમ લખ્યું છે તે પિચાશ એટલે શું તે અમોને જણાવશો ? એમોને તમારો ભાવાર્થ પિચાસને બદલે પીશાચ કહેવાનો હોય તેમ જણાય છે પણ તેવું કહેતાં કદાચ તમોને સનાતની ભાઇઓની બીક લાગતી હોય તેમ જણાય છે કારણ કે તેવાં લક્ષણો તમારામાં છે એ પૂરવાર થાય છે કે તમો પીરાણા–પંથીઓના પેટમાં પીરાણાના પીરોનીજ જ્યોત પ્રગટી રહી છે અને ઉપરથી તેવા ધર્મને હિંદુ ધર્મની હરોળમાં બતાવવા જાહેર જનતાને છેતરી રહ્યા હો તેવી રીતે બતાવતા જણાઓ છો તેથી તમારા જે લખેલાં લક્ષણો તે તમોનેજ મુબારક હો; અમોને તેની જરૂર નથી.

ભાઇશ્રી સનાતની ભાઇઓ કદાચ તમોને કહેતા હશે. તો તેમાં તમારે ખોટું લગાડવા જેવું નથી એતો તમો ને નહિ પણ તમારામાં રહેલા પીરાણા ધર્મનાં તત્વોને દૂર કરવા ભલામણ રૂપે તમોને ઉદ્દેશીને કહેતા હશે જે અમારા જ્ઞાતિ બંધુઓમાં જે હિંદુ ધર્મને ન શોભે એવાં તત્વો પીરાણાના ધર્મ ગુરૂઓએ ઘાલી અમારા જ્ઞાતિ બંધુઓને કાયર બનાવી દીધા છે કે જેને ચાલુ જમાનાનો સુધરેલો રંગ રાગ, પરિવર્તન, અને પવન તેને જાણવા તેમજ જોવાની જાગૃતિ સુદ્ધાં પણ આવતી નથી એ જાણી દુઃખ થાય છે માટેજ તમોને કહે છે.

ભાઇશ્રી તમારી ચોપડીના ચોથા પાનામાં તમો સનાતની ભાઇઓને ધમકી આપતાં લખો છો કે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરોમાં સતપથી ભાઇઓને તેમનાં પાદ પૂજા કરવામાં સનાતની ભાઇઓ જરાપણ રોક ટોક કરી શકશે નહિ અને કરશે તો નામદાર કાંગ્રેસ સરકાર સતપંથી ભાઇઓને સંપૂર્ણ રીતે મદદ કરશે. તો તેના જવાબમાં જણાવવાનું કે નામદાર કોંગ્રેસ સરકારે સનાતન ધર્મ પાળવાવાળા ભાઇઓની સામે લડવા માટે અને સતપંથી ભાઇઓને મદદ કરવા માટે જોઈતી રકમ કેંદ્રમાંથી તમોને આપવા દિલ્હીની પાર્લામેન્ટમાં કેટલી રકમ મંજુર કરી પાસ કરાવેલ છે તે જણાવશો કે ? અમોને જણાય છે કે તે રકમ કદાચ ચાલુ પંચ વર્ષીય યોજનામાંજ પાસ થઈ તમો પીરાણાપંથી ભાઇઓને મળી ગઇ હોય અગર મળવાની હોય તેથી ધમકી આપતા હો તેમ જણાય છે. અમોને ખાત્રી છે કે તેવી રકમ તમોને નામદાર કોંગ્રેસ સરકાર પાસેથી મળી નહી હોય. કદાચ મળવાની આશા રાખો તે પહેલાં ત્યાં જઇ પુરી ખાત્રી કરશો જે તમો પીરાણાપંથીઓની આશા રાખેલ રકમ પીરાણાપંથીઓ માટે છે કે પછી પાકીસ્તાન સામે પ્રજાના રક્ષણ માટેની છે તેની જો પૂરેપુરી ખાત્રી નહી કરો તો સમય આવ્યે હાથ ઘસતા ન રહી જવું પડે તેનો બંદોબસ્ત તમારે હમણાંથીજ કરવો જરૂરી છે એમ અમારી સલાહ છે.

realpatidar.com

https://archive.org/details/bk039/page/n8/mode/1up

1968-01-20 -Puchela Prashno -Gopal Somji Bhagat (39)

realpatidar.com

Propaganda to attract Satpanthis

ભાઇશ્રી આવા ખોટા ધમપછાડા કર્યે કંઇ વળવાનું નથી. આપણા સનાતની ભાઇઓ તમોને તો ખૂબજ ઇચ્છે છે. પણ તમારામાં રહેલા પીરાણા ધર્મને તો નહિંજ. સનાતની ભાઇઓ તો તમોને ખૂબજ આવકારે છે કે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનાં જે મંદીરો છે તે આપણા માટેજ બાંધ્યા છે કે જેમાં આપણે સૌ હળીમળી ભેગા બેસી પ્રેમથી ભગવાનના ગુણગાન, કીર્તન, ભજન, આદી સત્કર્મો કરીએ. પણ તમો મંદીરોમાં આવતાજ નથી તેથીજ અમોને દુઃખ થાય છે. અને જ્યાં સુધી તમો આવા પવિત્રસ્થાનોનો આશરો નહિ લ્યો ત્યાં સુધી તમારામાં રહેલું અજ્ઞાન દૂર થવાનું નથી. માટે તમો જો સાચા હો તો નિત્ય પ્રત્યે સાંજ સવાર મંદીરોમાં આવી ભગવાનનું ભજન સ્મરણ કરો તમોને કોઇ પણ ના પાડવાનું નથી જેની ખાત્રી રાખજો. સનાતની ભાઇઓ તમોને આવકારે છે કે ભાઇઓ આપણું સાચું ધર્મસ્થાન પીરાણું નહિ પણ આ સનાતન દેવનાં મંદિરોજ છે. આપણો આપસનો મૂળ બાંધો પ્રથમથીજ ધર્મ બાબતનો છે અને તે એ, કે, તમારો વિચાર મંદિરોમાં બધાને નિમાજ પઢાવવા કોશીષ કરાવવાની છે તે બનવું અસંભવિત છે કારણ કે નિમાજ તો મસજીદોમાંજ પઢાય, મંદીરોમાં તો નહિંજ. તમો જાણતા હો અગર નહિ જાણતા હો છતાં પણ મારે તમોને જણાવવું છે કે જે સ્થાનમાં જે દેવની સ્થાપના હોય તે સ્થાનમાં તેજ દેવનું ભજન ઉપાસના થાય પણ તે સ્થાનમાં બીજા અન્ય દેવની ભજન ભક્તિ કે ઉપાસના થતી નથી એ સિધ્ધાંત છે.

જેમ સોનું વસ્તુ એકજ છે પણ તેના ઘાટ પરત્વે નામો જુજવાં છે. તે જેવો ઘાટ તેવું નામ અને સ્થાન. હાથના ઘાટને પગમાં સ્થાન મળતું નથી તેમ નામ પણ મળતું નથી પણ જયારે બધા ઘાટને એકરસમય બનાવો ત્યારે આખરે હેમનું હેમજ છે. તેવી રીતે જગતમાં ભગવાન તો એકજ છે પણ તેને નામ પ્રમાણે સ્થાન મળે છે. જેમ કે રામ, કૃષ્ણ, શંકર, હનુમાન, દેવીઓ આદી જે હિંદુદેવોનાં જે નામો છે તેમનાં સ્થાન મંદીરોમાં છે ત્યારે પેગંબરો, પીર, ફકીર, ઓલીઆ, ખલીફા, મુજાવર, મોલવીઓ, મુરીદો, ઇમામો આદી જે મુસલમાનના પૂજ્ય-માનો છે તેમનાં સ્થાન મસજીદ, દરગાહ. રોજો, કબ્રસ્તાન, ખાનાં વગેરેમાં છે એવો એક પરંપરાથી ચાલ્યો આવતો ધાર્મિક રિવાજ છે. જે રીવાજોનું હિંદુ તેમજ મુસ્લીમ પોતપોતાના રીવાજ મુજબ હાલમાં પણ પાલન કરી રહ્યા છે.

ભાઇશ્રી તમો તમારી ચોપડીમાં પાંચમાં પાને લખો છો કે શ્રી નાનજીભાઇએ જણાવ્યું કે પીરાણાપંથી કે સતપંથી ભાઇઓ જે સતપંથને માની રહ્યા છે તેને ખંડીત કરવા એમ કહ્યું તો તેના જવાબમાં જણાવવાનું કે તમો ડાહ્યા અને સમજુ હો તો તમારે તેમની પાસેથી સમજી લેવું જોઇતું હતું કે જેથી એક બીજાના સમજની આપલે થાય પણ તમોએ તેમ કરવા કોશીષ કરી હોય તેમ જણાતું નથી. ભાઈ શ્રી નાનજીભાઇએ દુઃખ વ્યકત કર્યું કે હાલમાં જે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી જે ભાઇએનો પીરાણાપંથને માને છે જે પીરાણાધર્મ તેવાં ભાઇએનોના હૃદયમાં જડ ઘાલીને બેઠો છે તે ધર્મથી ભાઇએનોને ખંડીત કરીને જુદાં કરવાં. નહિંજ કે આપણા

realpatidar.com

https://archive.org/details/bk039/page/n9/mode/1up

realpatidar.com

ભાઇઓને. તમો તો અમારા ભાઇઓ છો જેનો પુરાવો સનાતની ભાઇઓ તો શું પણ તમો પોતેજ તમારા લખાણુના તાત્પર્યથી જણાવો છો કે જ્ઞાતિમાં દરેક રીતે પીરાણાપંથી ભાઇઓને મોખરે રાખી જ્ઞાતિનું સંચાલન ચાલે છે, તો તેમાં સનાતની ભાઇઓ કયાં ના પાડે છે? આપણા જ્ઞાતિ બાબતનો ઝગડો પહેલેથીજ નથી તો હવે શું થવાનો છે? અને એ સત્ય હકીકત છે કે જ્ઞાતિના દરેકે દરેક શુભ કાર્યો વખત આવે આપણે એકત્ર થઈ ખંભેખંભા મેળાવી પ્રેમથી કર્યાં છે, હાલમાં પણ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરશું એ તદ્દન સત્ય હકીકત છે. કદાચ વ્યવહાર કરવામાં મમત્વને લીધે વેર થોડી વખત રહે છે પણ વેરમાં ઝેર નથી એટલે એકલું વેર ટકી શકતું નથી એટલે જ વખત આવે આપણે એક બની રહીએ છીએ એટલે જ્ઞાતિ અને ધર્મ જુદાં જુદાં છે તેનો એ પૂરાવો છે. આપણો મૂળ વાંધો પ્રથમથીજ ધર્મ બાબતનો છે કે આપણા કડવા પાટીદાર જ્ઞાતિના સુપુત્રો શુદ્ધ સનતની હોવા છતાં આપણે માથે અર્ધ ઇમામી ધર્મનું કલંક શા માટે હોવું જોઇએ? તો તે કલંકરૂપી કાળાશને મટાડવા આપણા સનાતની ભાઇઓ ગામડે ગામ ફરી પોતાના જ્ઞાતિ બંધુઓની ખાતર આવી કારમી મોંઘવારીમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનાં મંદિરો બાંધી અને તેના ઉત્સવ નિમિત્તે આપ ભાઇઓને માન ભર્યાં આમંત્રણો આપી તમોને દરેક રીતે આગળ રાખી તમારામાં રહેલી ભૂલોનું ભાન કરાવવા માટેજ સંબોધે છે જે તમો હિંદુ છો તો હિંદુઓનાં નામ અને સ્થાન દીપાવો. અંધ શ્રધ્ધાના અંધારામાંથી ઊઠી સનાતન ધર્મના સંપર્કમાં આવો. પીરાણાધર્મનું આદી અને અંત શું છે તેનો વિચાર કરો? આવી રીતે કહેવાનો શ્રી નાનજીભાઈના ભાષણનો ભાવાર્થ હતો પણ તમારે તો તે વખતે જેમ કોઇના પેટમાં તેજાબ રેડાયો હોય અને તે આકળવિકળ થાય તેવી રીતે તમોને થયું હોય તેથી સાંભળવા પણ તૈયાર થયા નહિ એમ તમારા લખાણુના તાત્પર્ય ઉપરથી જણાય છે.

ભાઇશ્રી તમો લખો છો કે શ્રી નાનજીભાઇના ભાષણને ત્યાં બેઠેલા સંતમહાત્માઓએ તથા પ્રમુખશ્રીએ રોકવાને બદલે ખુબ ઉત્સાહથી તાલીઓના નાદથી અભિનંદન અને ધન્ય વાદ આપ્યા, ત્યારે તમારા પોતાના જ ભાષણને તમો પોતેજ સાતમા પાનામાં જણાવો છો કે પ્રમુખ શ્રીએ મારા ભાષણ તરફ ગુસ્સો કરી નથુભાઇને જાહેરાતમાં સૂચના આપી કે "બેસાડી દયો રવજીભાઇને?" "બસ રવજીભાઇ સમજ્યા કે?" એકજ જ્ઞાતિના બંને સુપુત્રો તમો તથા નાનજીભાઈ. તે નાનજીભાઇના ભાષણને ભાવભર્યો સ્વાગત અને તાલીઓના અવાજ સાથે માન ભર્યા અભિનંદન અને ધન્યવાદ ત્યારે તેના સામે તમારા ભાષણને ધિક્કાર અને અપમાન સાથે બેસી જઇ ચૂપ રહેવાનો હૂકમ? રવજીભાઇ આનું કારણ તમો સમજ્યા કે નહિ? જો ન સમજ્યા હો તો સમજી લેવા માટે હું તમોને ચાન્સ આપું છું તે પણ દષ્ટાંત રૂપે. જુઓ? એકજ સરકારના બે નોકર એક પોસ્ટમેન અને બીજો પોલીસ. આ બંને નોકરોનાં વિચાર અને વર્તમાં શું ફેર છે તે જુઓ? પેલો પોસ્ટમેન જયાર આપણે આંગણે આવે અગર આવતો હોય ત્યારે આપણે આનંદ અનુભવીએ છીએ કે કાંઇ પણ શુભ સમાચાર હશે—રાજી ખુશીના પત્રો અગર મનીઓર્ડર. એ તો રોજીંદો વ્યવહાર છે. પણ જયારે કોઇક સમે પોલીસ આપણા તેજ આંગણમાં આવતો હોય ત્યારે તેમને જોતાં પ્રથમ તો આપણને હૃદયમાં થડકો

realpatidar.com

https://archive.org/details/bk039/page/n10/mode/1up

realpatidar.com

પડે છે કે પોલીસ આપણા ઘરે શા માટે આવતો હશે ? પછી ભલેને દોસ્તી ખાતર અગર બીજા કોઇ કારણોસર પોતાની ફરજ બજાવવા આવતો હોય અગર આવ્યો હોય પણ તે વખતે આજુબાજુનાં માણસો પણ ભેગાં થઇ જાય અને તરતજ અંદરો અંદર કારણોની તપાસ ચાલુ થાય જે શું અહીત બન્યું છે. આ તો એક દૃષ્ટાંત છે પણ તેનો સિધ્ધાંત એ છે કે આપણા સનાતની ભાઇઓને પીરાણાધર્મથી જાગૃત રહેવા રૂપી શુભ સમાચારો આપવા શ્રી નાનજીભાઇ પોસ્ટમેન બનીને આણંદસર ગામને આંગણે આવ્યા. ત્યારે "તમે" પીરાણાપંથના પ્રતિકરૂપે પોલીસ બનીને પહેલાવહેલા પધાર્યા તો તમારા તરફ અણગમો થયો ? ત્યારે હવે તમોજ કહો કે માનપત્ર શુભ સમાચાર લાવનાર પોસ્ટમેનને કે પીરાણાના પ્રતિકરૂપે પોલીસ જણાતા રવજીભાઇને ? તે વખતે શ્રી નાનજીભાઈ બન્યા સનાતની અને તમો બન્યા સતપંથી. શ્રી નાનજીભાઈ હિંદુધર્મના હિમાયતી અને તમો કબ્રસ્તાની પાકા પીરાણાપંથી. એવું જ્યારે જાહેર સભાને જણાયું હશે ત્યારે તમો બંનેને જેવા દેવ તેવી પૂજા થઇ. તેમાં ભાઇશ્રી તમોને ખોટું લગાડવું તે વ્યાજબી ગણાય નહિ.

ભાઇશ્રી અમારા સાંભળવામાં આવ્યું છે કે શ્રીમાન નથુભાઇ નાનજીએ તમોને સનાતન ધર્મ અને પીરાણાધર્મ એ બે માં સાચું શું છે, તે સમજાવવા માટે તમોને બે દીવસ રોકાઇ જવાની તમારી પાસે માગણી કરી જે આપણે ભેગા બેસીને તે બાબતની ચર્ચા કરીએ તો એક બીજાની ભૂલ સમજાય, પણ તેમાં તો તમો ગભરાઇ ગયા અને રાત લઇને પૂછ્યા વગર ભાગવાનો તમોને સમય શોધવો પડ્યો. તો ભાઈશ્રી કદાચ જો આ વાત સાચી હોય તો તમારે માટે યોગ્ય ગણાય જ નહિ કારણ કે તમો પ્રખર પીરાણાપંથી એટલે તમારે જ્ઞાતિ ખાતર બે દીવસ રોકાઇને પણ સનાતની ભાઇઓને તમારા પીરાણપંથી બોધથી મહાત કરીને ત્યાં સતપંથ પીરાણાધર્મનો વિજયી વાવટો ફરકાવવો હતો કે જેથી સનાતનીઓ મંદીરોને બદલે પીરાણાનાધર્મને માનતા થઇ જાત, ઉપરાંત પીરાણા સતપંથનો વાળપણ વાંકો કરી શકત નહિ તો તેમ તમોએ કાંઈ પણ કર્યું નહિ. તેથી જણાય છે કે તમો સતપંથી સનાતની ભાઇઓથી ચોક્સ ડરી ગયા છો એમ પૂરવાર થાય છે. "વાહ રવજીભાઇ વાહ" અ તે તમારી છાતી કે છાણું ? તમારૂં હૈયું કે હાંડલું ? આમ થોડીક સનાતની ભાઇઓની ગર્જનાથી ઉભી પૂછડીએ નાસતાં શીખશો તો મોરાના પંથ હજી લાંબા છે એમ હૈયાથી હારવાનું નથી આપણે તો હજી ધર્મયુદ્ધ જાણુવાનું છે. આમ કાયર બની ભાગવાનું નથી.

ભાઇશ્રી તમો તમારી ચોપડીના ૯ મા પાનમાં જણાવો છો કે શ્રી નાનજીભાઇને શું એ ખ્યાલ નથી કે ગાંધીજી તો આ 'સતપંથ' ધર્મના આદર્શોને આચારમાં મૂકી ઉપદેશ આપી ગયા છે તો તેના જવાબમાં જણાવવાનું કે શ્રી નાનજીભાઇને ગાંધીજીના વિચારોની ખાત્રી હતી કે તેઓ શુદ્ધ સનાતની હતા ભાઇશ્રી અમો તમોને પૂછવા માગીએ છીએ કે પૂજ્ય ગાંધીજી તમારે ત્યાં કઈ સાલે અને કઇ તારીખે પધારી તમારા કબ્રસ્તાની પીરાણાસતપંથ ધર્મના આદર્શો તમોને કઈ રીતે સમજાવી ગયા છે તેનો કોઇ પણ લેખ

realpatidar.com

https://archive.org/details/bk039/page/n11/mode/1up

realpatidar.com

અગર સાચો પુરાવો તમારી પાસે હોય તો અમોને લેખીતવાર જાહેરાતમાં જણાવશો કે? ભાઇશ્રી તમોએ તો કબ્રસ્તાની પીરાણાની ગોળી પીધી હશે અને કદાચ પીતા પણ હશો. પણ પેલા પુજ્ય ગાંધી બાપુને તો છેતર્યા નથી ને? અમોને શંકા છે કે જરૂર તમો પીરાણાપંથીઓએ બીચારા મહાત્માને ધર્મમાં ધોખો દીધો હશે અને ગોળી પાઇ હશે કે જેને પાપેજ બીચારા બાપુને સાચી ગોળીઓનો ભોગ બનવું પડયું હોય એમ કદાચ અનુમાન કરીએ તો તે અસ્થાને ગણાય કે નહિ? “વાહ રવજીભાઇ વાહ” આવા પવિત્ર ગાંધી બાપુને તમારા સતપંથમાં સપડાવી સતપંથના આદર્શો પાળવાનો પરબારો ગાંધીજીદ્વારા હવાલો અપાવ્યો ને?

ભાઇશ્રી તમો લખો છો કે સતપંથ ધર્મની સુગ અને તેનું નામ લેતા અભડાતા એવા સનાતનીઓ સનાતનધર્મના જય નાદની બાંગો પોકારો છો જેમ મુલ્લાં મસજીદમાં અલ્લાહની બાંગ પોકારે છે તેમ. એમ દ્રષ્ટાંત પુરાવા સહીત જણાવો છો તો તેના જવાબમાં અમો તમારા પાસેથીજ જાણવા માગીએ છીએ કે તમોને તમારા સતપંથ સાથે મુંલ્લાં અને મસજીદ એ બંને એકદમ કેમ યાદ આવી ગયાં? શું તમોને હિંદુ સનાતન ધર્મના જય નાદોના અવાજ તમારા કાનમાં ખટકવા લાગ્યા કે શું? કે જેની અદેખાઇ રૂપી વેદનાથીજ તમોને તમારા ઇષ્ટદેવના સેવકો અને સ્થાન યાદ આવ્યાં હોય એમ અનુમાન થાય છે જગતમાં કહેવત છે કે “ઉંટ મરે ત્યારે મારવાડ તરફ મોઢું કરે” તેમ આખરે તમોએ હિંદુ પણાનું ગૌરવ ભુલી જઇ તેવા પવિત્રસ્થાનોમાં પણ તમારી મુરાદ વડે તમારામાં રહેલાં છુપા છળો આખરે જાહેરાતમાં જણાવ્યાં હોય એમ અમોને જણાય છે. ભાઇશ્રી અમો તમોને છાની રીતે પુછીએ છીએ કે તમો પીરાણાપંથી ભાઇઓ મુલ્લાં પાસેથી બાંગોને લગતું કાંઇ પણ જ્ઞાન મેળવ્યું છે કે કેમ? અને તે જ્ઞાનમાં તમો પીરાણાપંથીઓ કેટલા આગળ વધી અને મુલ્લાં જેવા બન્યા છો તે જરા જણાવશો કે? ભાઇશ્રી અમોને તો તે વાત બીલકુલ ગળે ઉતરતી નથી પણ આજ કાલ તમારા જેવા પ્રખર પીરાણાપંથીઓ જાહેરાતમાં હિંદુ સનાતન ધર્મનાં ચેડા કરે તો પછી અમારે શું સમજવું? એટલેજ અમો તમોને પુછીએ છીએ કે તમો પીરાણાપંથીઓ છુપી રીતે કઇ જાતના હિંદુઓ બનવાની આશા સેવી રહ્યા છો? તે જણાવશો કે?

ભાઇશ્રી તમો લખો છો કે સ્વ. નારાણભાઈ જેવા કરોડો નારાણભાઇઓનો કે આર્યકવી જીવણભાઇઓનો કે કરોડો નાનજીભાઇઓનો રાફડો ફાટશે તો પણ પીરાણા સંપ્રદાયના સતપંથ ધર્મના સર્જનહારના માલીકનો તમારાથી એક વાળ પણ તુટવાનો નથી સમજ્યા? તમને ખ્યાલ છે ને? કે હજરત પેગંબરનો વાળ કેટલો કીંમતી છે?

ભાઇશ્રી આવી રીતે તમો તમારી જ્ઞાતીના જોરે સનાતની ભાઇઓને જાહેરમાં ધમકીઓ આપો છો. તો તેના જવાબમાં જણાવવાનું કે ભાઇશ્રી તમારા જણાવ્યા મુજબ સતપંથ પીરાણા ધર્મના સર્જનહાર તો પીરઇમામશાહ છે એમ તેના ઇતિહાસો પરથી

realpatidar.com

https://archive.org/details/bk039/page/n12/mode/1up

realpatidar.com

જણાય છે તો તે બાબત અમો તમોને પૂછીએ છીએ કે તમો પીરાણાપંથઓ પીર ઇમામશાહના અનુયાયી ગણાઓ છો તેવી રીતે સનાતની ભાઇઓ સનાતન એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવના અગર સનાતન હિંદુ ધર્મના ફાંટા રૂપ બીજા હિંદુ દેવના અનુયાયીઓ છે તે સૌ પોતપોતાના ઇષ્ટદેવની ઉપાસના ભકિત કર્યે જાય છે તો તમારી ભકિત તો હિંદુએન અને મુસલમાનભાઇ તેમના જેવી હોય તેમ જણાય છે. ભાઈશ્રી તમો એટલું તો જાણો છો કે મુસલમાનો પોતાના સગા કાકાની દીકરી જે બેન કહેવાય તેની સાથે લગ્ન વહેવાર કરે છે અને તેને એક સામાજીક રીવાજ કરી બેઠા છે તો ભાઇશ્રી હિંદુ બેનની સગાઇ મુસલમાન ભાઈ કયાં સુધી રાખશે? આ તો એક દષ્ટાંત છે પણ તેનો સિદ્ધાંત એ છે કે તમો સાચા હિંદુ થઇ એક મુસલમાન તેમજ મુસલમાનના રચેલા તદ્દન કલ્પીત એવા અર્ધ ઇમામી પંથનો રાહ લઇ તેમના સંસર્ગમાં રહેશો તો વખત આવે તમો પીરાણાપંથીઓને પોતાના જેવા નહિ બનાવો તેની ખાત્રી શું? વળી તેનો વાળ પણ વાંકો થવાનો નથી એવી જાતની જોરદાર ધમકીઓ સનાતની હિંદુભાઇઓ સામે જાણે તમે સાચા મુસલમાની બોલતા હો તેવી રીતે એક માતેલા આખલાની જેમ ધૂળ ઉડાડતા ત્રાડુકતા હો તેવી રીતે સામનો કરતા જણાઓ છો. ભાઈશ્રી એવા પેગમ્બરી વાળનું વળતર જે પેગમ્બરી હોય તેજ માગે, હિંદુઓ નહિ. તમે તો તેવા પેગમ્બરી વાળનું વળતર તથા કીંમત આંકવાનો જાણે ઇજારો લીધો હોય તેવી રીતે જાહેર કરતા હો તેમ જણાય છે. ભાઇશ્રી આવો એકલતરફો મુસલમાની પક્ષ જણાવશો તો જગતના હિંદુઓ તમોને હિંદુ તરીકે ગણશે કે કેમ? તેનો વિચાર તમારે જ કરવાનો છે.

ભાઇશ્રી તમારી ચોપડીના અઢારમા પાનામાં લખો છો કે સતપંથીઓ પોતાની સહનશીલતા જે છોડવા માગતા નથી તો પણ તમો સુતેલા નાગને જગાડવા સાહસ કરી રહ્યા છો. તો તેના જવાબમાં જણાવવાનું કે સુતેલા નાગો કાયમને માટે સુઇ ગયા છે કે કેમ? જો કાયમને માટે સુઇ ગયા હોય તો જગાડવાનું સાહસ કરવું નકામું છે કારણ કે તે કુદરતની સામે થવા જેવું છે. તો તેવો સાહસ રૂપી સામનો કરવા સનાતનીઓ શકિતમાન નથી બલ્કે પ્રભુ સિવાય કોઇ પણ નથી. અને તેવા નાગો કાયમ માટે સુઇ જાય એમ સનાતનીઓ ઇચ્છતા પણ નથી. જો સુતેલા હશે તો સનાતનીઓ તેમને અંધશ્રધ્ધારૂપી ઘોર નિદ્રાથી જાગૃત કરવાનું સાહસ જરૂર કરશે તેમાં કાંઇપણ શંકા નથી. જે અમારા સાચા ભાઇઓને પીરાણાના ધર્મગુરૂઓએ પીરાણાની ગોળી પાઇને અંધશ્રધ્ધાથી બેશુદ્ધ બનાવી દીધા છે તેને જાગૃતિમાં લાવવા તેમના સનાતની ભાઇઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. ભાઈશ્રી તમોએ લખેલા નાગોમાંથી સનાતની ભાઇઓના ભૂતકાળના તેમજ હાલના નેતાઓએ મળી ઝેર ખેંચી ખોખાં કરી દીધા છે. ખરા સાપ તો ચાલ્યા ગયા હવે તમો બધા પીરાણાપંથીઓ લીસોટા રૂપે રહ્યા છો એમ જણાય છે તો તેને વખત આવે ફીટાડવામાં જરા પણ વાર લાગશે નહિ.

realpatidar.com

https://archive.org/details/bk039/page/n13/mode/1up

realpatidar.com

ભાઈશ્રી તમારા લખાણમાં ૧૯ મા પાનાના "વાહ ચેતમછંદર વાહ" તમોને પોતાને ચેતમછંદર કહેવડાવાનો ચાવલો ક્યારથી ચડયો ? તે જણાવશો કે ? તમો "ચેતમછંદર" બની પીરાણાની માયા નગરીમાં ફસાણા છો તો તેનાથી તમોને છોડાવવા સનાતનીઓ ગોરખ બનીને ઉભા છે એટલે હવે તમારે ચોકકસ સમજી લેવાનું છે કે માયા નગરીમાં ફસાએલા ગુરૂને ચેલા તેમનાથી જરૂર મુકત કરશે તેની ફીકર કરશો નહિ.

ભાઈશ્રી તમો લખો છો કે સતપંથ ધર્મના આદર્શોમાં હીંદુ કે મુસલમાન કોમવાદના ભેદભાવ નથી આ સતપંથ ધર્મના ઉપદેશકોએ વેદ અને કુરાન, હીંદુ કે મુસલમાન આવો ભેદભાવ રાખેલ નથી એમ તમારા લખાણ પરથી જણાવો છો તો તેના જવાબમાં સ્વ. નારાણજીભાઈએ "હિંદુ ધર્મને નામે ચાલતા અર્ધદગ્ધ કબ્રસ્તાની પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ" એ નામે પુસ્તક છપાવી સંવત ૧૯૮૨-ઇ. સ. ૧૯૨૬ માં બહાર પાડયું છે. તો તેના લખાણના તાત્પર્યમાં જણાવે છે કે પીરાણાના પીર ઇમામશાહે રચેલો સતપંથી પીરાણા ધર્મ હિંદુધર્મ નહિ પણ ભેળસેળીઓ અર્ધદગ્ધ કબ્રસ્તાની એક મુસલમાન ધર્મ છે જેને પાળવાથી હિંદુઓના નામ અને નિશાનને કલંક લાગે એવું છે એવો સચોટ પુરાવો જાહેરમાં છપાવી પ્રસિધ્ધ કર્યો છે. જેને ખોટું છે એમ સાબીત કરવાને પીરાણાપંથના ધર્મગુરૂઓ કે પીરાણાપંથીઓમાંથી આજ દીવસ સુધી કોઇ પણ ઉભો થયો હોય તેવું જણાતું નથી. મોઢાથી પીરાણાપંથીઓએ બણુગા ફૂંકયાં હશે "જેમ બાયલો નર બૈરી આગળ શૂરો" એવી રીતે પીરાણાના ધર્મસ્થાનોમાં બેસી ભોળા ભાઇઓને ઉંધું ચતું સમજાવી પોતાના પેટની પૂજાની ખાતર પોતાની ખબરદારી બતાવી હશે પણ સનાતની ભાઇઓની જેમ છડે ચોક જાહેરમાં પોતાના મહારથી ભાષણોથી તેમજ લખાણો છપાવીને પીરાણા ધર્મની ઇમારતોના પાયાને તેના મૂળમાંથી હચમચાવીને પીરાણા ધર્મગુરૂઓ તથા પીરાણાપંથીઓના સાંધેસાંધા ઢીલા કરી નાખી પીરાણાધર્મથી અનેક ભાઇબેનોને મુકત કર્યા છે. તો તેવી રીતે જો પીરાણાપંથીઓ કે તેમના ધર્મગુરૂઓ જાહેરમાં આવી પીરાણા-ધર્મને ભેળસેળીઓ મુસલમાન ધર્મ નાહે પણ ચોકખો હિંદુ ધર્મ છે એમ જાહેર કરી છપાવી પીરાણાધર્મની જય બોલાવે તો ખરા. નહિ તો એકવાર નહિ પણ હજારવાર જુઠું છે એમ સનાતની ભાઇઓ કહે છે અને કહેશે એમ પીરાણાપંથીઓએ માની લેવાનું છે. માટે કોઠા યુધ્ધ રચી વહેલી તકે સનાતની ભાઇઓને સંદેશાઓ મોકલો તો તેવા સંદેશાને આવકારી બીડું ઝડપવાને સનાતનીઓ તલપી રહ્યાં છે તો તેની તલપો તમો સતપંથી ભાઇઓ ક્યારે છીપાવશો તેની રાહ જોઇ રહ્યા છે.

ભાઈશ્રી કેટલીક મારી અગત્યની શંકાઓનાં નિવારણાર્થે તમારી આગળ નીચે પ્રમાણે લખેલ મુજબ સવાલોના જવાબો જે સત્ય હકીકત તમોએ જાણી અગર જોઈ હોય તે મુજબ યથાર્થ રીતે અમોને જણાવવા મહેરબાની કરશો :

realpatidar.com

realpatidar.com

(૧) પીરાણાપંથમાં પ્રસાદીરૂપે વપરાતી ગોળી (પાવળ) તે શેમાંથી બને છે?

(૨) અમારા સાંભળવામાં પૂર્વે આવ્યું હતું કે પીરાણાના ગાદીપતી કાકાઓ જે હિંદુ કોમમાંથી થાય છે તેને પ્રથમ સુન્નતની ક્રીયા કરાવ્યા પછી તેનો ધર્મ ગાદીપર અભિષેક થાય છે તે વાત સાચી છે કે ખોટી છે તેનો હા અગર ના નો જવાબ.

Sunnat

(૩) પીરાણા ધર્મમાં દરેક ધાર્મિક ક્રીયાઓ કોના દ્વારા કરવામાં આવે છે અને તેની શરૂઆત ક્યા મંત્રોથી થાય છે એવી બે ચાર દોવાઓ ના મંત્રો લખી જાહેર કરવા,

(૪) પીરાણા ધર્મસ્થાનોમાં કયા હિંદુદેવની પ્રતિમાઓ છે અને તેની પાઠ પૂજા કયા મંત્રોથી થાય છે? અને તેવી પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કયા બ્રાહ્મણો દ્વારા થાય છે? અને આરતી, ભજન, ધૂન થયા પછી કયા દેવની જય બોલાવાય છે? તેમજ પીરાણા ધર્મનાં પુષ્ટીકારક એવાં કયા શાસ્ત્રોનું તેમના અનુયાયીઓને ધર્મબોધ અપાય છે તે ખુલાસાવાર જણાવશો.

(૫) પીરાણાપંથમાં મનાતા પીરાણા ગામે પીરાણાના ધર્મસ્થાનમાં કયા કયા દેવોની મૂર્તિઓ તથા પ્રતિમાઓ છે તેનાં નામ સાથે સ્થાન જણાવશો.

(૬) પીરાણાપંથીઓ મધ્યરાત્રીએ શુક્રવારી બીજ ઉજવે છે કે કેમ?

(૭) લગ્ન વખતે કલમા તેમજ દોવા પઢતા કે નહિ (હાલમાં સરકારે તે પ્રથા બંધ કરી હોય તેમ લાગે છે.)

(૮) પાંચ વર્ષથી ઉપરના મૃતદેહોને સ્મશાનમાં અગ્નિસંસ્કાર થાય છે કે પછી કબ્રસ્તાનમાં દફનાવે છે?

(૯) માણસ મરી ગયા પછી ત્રીજે દીવસે જારતની ક્રિયા કરે છે કે નહિ?

(૧૦) જેમ હિંદુ, મુસલમાન, વગેરે કોમના ધર્મશાસ્ત્રો બજારોમાંથી તેમજ તેમના ધર્મસ્થાનો પરથી તેમજ જાહેર લાયબ્રેરીઓમાંથી વેચાતાં તેમજ વાંચવા મળે છે. તેવી રીતે પીરાણાપંથનાં ધર્મ શાસ્ત્રો કયા સ્થળે મળે છે તે જણાવશો. બજારમાંથી તેવાં પુસ્તકો જાણવા તેમજ જોવા માટે વેચાતાં તેમજ વાંચવા માટે મળતાં નથી. માટે પીરાણાધર્મનાં પુસ્તકોની છપાઈ ને જાહેરાત થાય છે કે નહિ? આવી રીતે અમારી શંકાઓનું સમાધાન આપ અમોને સંતોષભર્યું લખી છપાવી જાહેરમાં આપશો એવી આશા રાખીએ છીએ.

ભાઈશ્રી અમોને એક અનેરો આનંદ તમારાથી રહેતો હોય તેવી રીતે તમો આપણા સનાતની ભાઈઓને મંદીરો બનાવવામાં મદદ કરી તેમજ સનાતન ધર્મમાં આગળ લેવામાં છૂપી રીતે તેમજ જાહેરમાં તેવા મંદીરોના ઉત્સવ સામૈયામાં દરેક રીતે આગળ પડતો ભાગ લીધે જાઓ છો એમ તમારા લખાણથી જણાવો છો. જે આપણા પીરાણાપંથી ભાઈઓની સનાતની ભાઈઓ પ્રત્યેની સુનીતિ અને પ્રેમ લાગણી વડે સનાતન ધર્મમાં

realpatidar.com

https://archive.org/details/bk039/page/n15/mode/1up

realpatidar.com

આગળ વધારી ગુજરાત તથા કચ્છના ગામડે ગામડે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ આદી દેવનાં મંદીરો બનાવવામાં મદદરૂપ બની સતપંથી ભાઇઓ જાણે અગાઉથીજ તેવાં મંદિરોની ગોઠવણો કરી રાખવા માગતા હોય કે પાછળથી બાકી રહેલા પીરાણા સતપંથી ભાઇઓ જાણે એકદમ સનાતની બની જવા માગતા હોય તેવી રીતે મંદિરોની તકલીફો દૂર કરી રહ્યા હોય તેવી રીતે તમારો ભવિષ્યનો અમારા પ્રત્યેનો ભાવ અમો અનુભવતા રહીએ તેવી રીતે અમોને જણાવો છો. તો ભાઇશ્રી તેવું તમારે કરવું હોય તો ભલે ખુશીથી કરજો પણ પાછળથી તમો સતપંથીઓ એકદમ સનાતની બની પીરાણાના પેગમ્બરોને છુપી રીતે છેતરી સાચા હિંદુધર્મની હોંશને હૈયામાં રાખી પાછળથી પીરાણા ધર્મને તલાકનામું આપો તે પહેલાં પીરાણા માટે તમારામાંથી વધારે નહિ તો છેવટે અઢી મુમનો રહે તેવો યોગ્ય બંદોબસ્ત કરીને પછી સનાતની બનો તો વધારે સારૂં ગણાય. કારણ કે ભુતકાળથી ગુજરાત તેમજ કચ્છના ગામેગામમાં પીરાણા ધર્મના આડતીઆ અને એઠીઆ એવા મુજાવર રૂપે મુખીઓએ પીરાણા ધર્મના કાકાઓ તથા સૈયદોનાં વિલાસી જીવનનોને પોષવામાં બિચારા ગરીબ અને કંગાલ કણબીઓના પસીનાના પૈસાથી તાગડધીન્ના આજ દિવસ સુધી પોતે પણ સાથે રહીને કરતા આવ્યા હોય અને તેવાઓની એવી અખૂટ આજીવિકાઓ જ્યારે અધ્ધર ત્રાજવે તોળાઇ રહી હોય, ત્યારે હૈયામાં મરણ પામેલી ઉર્મિઓને થોડી સજીવન રાખવા માટે તેવા જો અઢી મુમનો હોય તો તેમનાં મોઢાં જોઇને તેઓને મન વાળવા થાય.

2.5 મુમના

ભાઇશ્રી તમો સાચા હિંદુ બનીને ધર્મમાં ધતીંગ ચલાવો છો તે જાણી અમોને દુઃખ થાય છે જે આપણી જ્ઞાતિમાંથી અમુક ભાઇઓ જ્યાં સુધી ધર્મમાં ચોકખા નથી ત્યાં સુધી આપણામાંથી ધર્મ બાબતનો અંતરાયરૂપી રોગ નીકળતો નથી. ખરી રીતે તમોને પીરાણાની પીરાઇનો મોહ રાખવો જોઇએ નહિ. છતાં પણ રાખો છો એ અમોને યોગ્ય લાગતું નથી. જેમ હિંદુઓમાં પણ કેટલાક ભોળા અને અજ્ઞાનીઓ છે તેઓ જેમ પીર ફકીરની મતલબની ખાતર માનતા કરે છે તેવી રીતિ તમોને યોગ્ય લાગે તો ભલે કરશો પણ તમોને એટલું તો જરૂર જાણવાનું રહેશે કે જેમ હીંદુઓમાંથી કેટલાક પોતાના મતલબની ખાતર કાલાઘેલા બની પોતામાં રહેલી અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાનુ જાહેરમાં પ્રદર્શન કરાવવા માટે મુસલમાનોના ધર્મસ્થાનો જેવાં કે દરગાહ, રોજો, કબ્રસ્તાન, ખાનાં વગેરે સ્થાનોમાં મુસલમાન ભેગા રહી તેમનાં માનેલાં પ્રસાદોની આપ લે કરતા હોય તેવી રીતે કોઇપણ મુસલમાન ભાઈ અગર બેન જાહેરમાં અગર છુપી રીતે હીંદુઓના શ્રેયમાં દબાઇ હિંદુઓના દેવોની પોતાના મતલબની ખાતર કોઇ પણ હિંદુઓના ધર્મસ્થાનોમાં અજ્ઞાની હિંદુઓની જેમ પોતાના સમાજનું તથા પોતાના ધર્મનું નાક કપાવવા આવે છે કે નહિ ? એટલું જો તમો સાચા હિંદુ થઇ જાણવા માગશો તો તમોને તમારામાં રહેલી ભુલોનું આપોઆપ જ્ઞાન થશે જે આપણે એક હીંદુ થઇને વિધર્મીઓના મોહમાં રહીશું તો ખરેખર આપણી જાતને ભુલી ગયા બરોબર જણાશે. ભાઇશ્રી આપણે એક જ જ્ઞાતિ છીએ તો આપણો હિંદુધર્મ સનાતન

realpatidar.com

https://archive.org/details/bk039/page/n16/mode/1up

realpatidar.com

છે તો હિંદુ ધર્મનું નાક જાળવતા જ્ઞાતિને અનુરૂપ એવા હિંદુ ધર્મના કોઇપણ હિંદુ દેવને માનશો તો અમારે અને તમારે સુમેળ રહેશે જેમ આપણો સામાજિક બાબતમાં કોઇ પણ જાતનો વાંધો નથી અને ખૂબ સંપ અને એકતા છે તેવી રીતે આપણે બધા આપણી જ્ઞાતિને અનુરૂપ એવો જે હિંદુધર્મ તેનુંજ પાલન કરીએ તો આપણામાં રહેલો થોડોક ધર્મ બાબતના વિવાદનો અંત આવી જાય. એટલું જ નહિ પણ આપણા ભારત વર્ષમાં હાલમાં આપણી જ્ઞાતિ સંપ અને સંગઠનમાં જગતના દરેક સમાજથી મોખરે સ્થાન ધરાવે છે તો તેનો પાયો મજબુત કરવા માટે માત્ર એકજ જ્ઞાતિ અને એકજ સનાતન ધર્મ તે રૂપી વજ્રની ભૂલીમાં વજ્રની ખીંટી મારતાં આપોઆપ એક બની એવી મજબુત બનશે કે કોઇનીપણ તાકાત નથી કે તેવી ખીંટીનો પરાભવ કરી શકે. ભાઇશ્રી આપણી સમાજ રૂપી વજ્રની ભૂમિને વજ્રની ખીંટીની જરૂર છે તો હવે તેવી ખીંટી મારવા તમારા જેવા ભાઇઓની જરૂર છે. પાછળની સમાજને સુદૃઢ બનાવવો એ સુકાન તમારે હાથ છે. તો તમો સાચા સુકાની બની સનાતન ધર્મની સમીપ આવવા તમારા સતપંથી ભાઇઓને ક્યારે સંદેશાઓ મોકલો છો ? ભાઇશ્રી આપણા સમાજની ત્રણ શકિતઓ જે ખેતર, ખળું અને સનાતન ધર્મ રૂપી ખીંટી એ ત્રણે શકિતઓ આપણામાં મજબુત હશે તો જગતની કોઇપણ સંસ્થા કે સત્તા તેમને પરાભવ કરી શકશે નહિ એ નિર્વિવાદ છે.

ભાઇશ્રી સ્વ. નારણજીભાઇએ સંવત ૧૯૭૯ ની સાલે પોતાના નામથી "પ્રાસ્તવીક નિબંધ" એ નામે એક નાની પુસ્તિકા છપાવીને પ્રસિદ્ધ કરેલ છે જેમાંની કેટલીક અગત્યની બાબતો સ્વ. વાલજીભાઈ જીવરાજે "કર્તવ્ય પંથે" નામના પુસ્તકમાં પાને ૭૧ થી રજુ કરી જાહેર કરેલ છે કે તે પુસ્તિકા પણ જાણવા જેવી હકીકતો પૂરી પાડે છે. તે સિવાય ખાસ મહત્વની બાબત તો પીરાણા સતપંથ ધર્મએ મુસલમાની ધર્મ છે તેને જો હિંદુ ધર્મ છે એમ તે વખતના મુજાવર કાકા લક્ષ્મણ કરમશી પૂરવાર કરી આપે તો રૂા. ૧૦૦૦૦), દશ હજાર રોકડા આપવાની નીચે પ્રમાણે ખુલ્લી ચેલેંજ સ્વ. નારાણજીભાઇએ કરેલી. લક્ષ્મણ કાકાને ચેલેંજ—

લક્ષ્મણ કાકાને હું નીચે પ્રમાણે ચેલેંજ કરૂં છું:—

(૧) તમે જન્મ વખતે કદાચ કડવા પાટીદાર હશો પણ હવે કણબી કે પાટીદારની જ્ઞાતિમાંથી વટલીને ઉતરી ગએલા છો. મુમના સિવાયના કચ્છ કે ગુજરાતના કણબીઓ તમને કોઇ દીવસ સાથે બેસાડી જમાડેજ નહિ. એટલે તમારા કહેવા પ્રમાણે તમે કડવા લેવા કણબી હવે રહ્યા નથી.

(૨) પીરાણા સતપંથ ધર્મ એ હિંદુ ધર્મ નથી. હિંદુ ધર્મની અનેક શાખાઓ છે તેના ધર્મગુરૂઓ પણ છે. અને તે કોઇ ઇમામશાહે ચલાવેલા તમારા પંથને હિંદુધર્મ તરીકે સ્વીકારતાજ નથી.

(૩) જે કણબીઓને તમારા ઇમામી મીશનની પૂરેપૂરી માહીતી નથી તેમને તમે પીરાણા સતપંથ એ હિંદુ ધર્મ છે એમ ખોટી રીતે મનાવો છો અને કચ્છના અમારા જ્ઞાતિભાઇઓના પૈસાનો એ મુમના પંથમાં ઉપયોગ કરો છો તે ઘણી વખત તમારૂં કાકાપણું ટકાવી રાખવા અને કચ્છના કણબીઓને મુમના બનાવવા અને મુસલમાની રાહ ઉપર લઇ જવા અત્યાર સુધી વાપરતા આવ્યા છો.

realpatidar.com

https://archive.org/details/bk039/page/n17/mode/1up

realpatidar.com

(૪) ઉપર જણાવેલા ત્રણે આક્ષેપો તદ્દન જુઠ્ઠા છે એવું તમે કોર્ટ મારફતે અથવા સનાતન હિંદુ ધર્મના આચાર્યો મારફતે એટલે હિંદુ ધર્મશાસ્ત્રની રાહે સાબીત કરી આપો તો હું રૂા. ૧૦૦૦૦) અંકે દશ હજાર આપવાને તૈયાર છું. અને તે વાત તમે જો ન સાબીત કરી શકો તો રૂા. ૧૦૦૦૦) દશ હજાર તમારે મને આપવા માટેની જવાબદારી માથે સ્વીકારવી જોઇએ. નહી તો હવે પછી ઉપર જણાવેલા આક્ષેપો તમને કબુલ છે. એમ અમારા સુધારકો અને અમારૂં મંડળ માનતું આવ્યું છે તે વાત તમને જાહેર રીતે માન્ય છે એમ દરેક જણને માનવાનું ચોકકસ થઇ જશે. આ ચેલેંજનો જવાબ આ નિબંધ તમને પહોંચ્યા પછી એક મહીના સુધીમાં આપવાની તમને છૂટ છે.

આજ દીવસ સુધી ઉપરોકત ચેલેંજનો ખરાખોટાપણાનો કોઇપણ જવાબ કાકા અથવા પીરાણાના કબ્રસ્તાનમાંથી હરીવંશના હોંશીલા સૈયદો આપવાને બહાર પડયા નથી. ખરૂં હોય તોજ જવાબ આપવાની હિંમ્મત કરે ને? તદ્દન જુઠ્ઠું; હજાર વાર જુઠ્ઠું!

ભાઇશ્રી આજથી લગભગ ચુમાલીશ વર્ષ ઉપર એટલે સંવત ૧૯૮૦-ઇ. સ. ૧૯૨૩માં તા. ૫-૭-૧૯૨૩ના રોજે ડીસ્ટ્રીકટ માજીસ્ટ્રેટ અમદાવાદ વાળાએ કોર્ટમાં તમારા પીરાણા પંથના ધર્મગુરૂ લક્ષ્મણ કાકાની જુબાની લીધેલી છે. તે સિવાય સુરતના ફ. ક. માજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં તા. ૧૩-૬-૧૯૧૯માં પીરાણા ધર્મ બાબતનો કેસ ચાલેલ છે તેનો કેસ વાંચી જવા તમોને ભલામણ કરીએ છીએ. આ બધું જાણવા માટે તમારે નીચે મુજબ છપાએલ ચોપડી વાંચવી.

પીરાણા-સતપંથનો કોર્ટમાં થએલો ફેંસલો. સુરત શહેરની કોર્ટમાં ચાલેલો મુકદ્દમો

પ્રસિદ્ધ કરનાર-રણછોડદાસ દલસુખરામ ભગત. શાક બજાર-અમદાવાદ મુદ્રક-પરાગજી ખંડુભાઈ દેશાઇ. નવયુગ મુદ્રણાલય-સુરત. સંવત ૧૯૮૦ આવૃત્તિ-૧ કિંમત ૦-૧-૩

આવી રીતે જાહેરમાં પીરાણા ધર્મ કેટલો હિંદુધર્મ છે તેની જાણ દરેકને હોતાં કેટલાક ગમાર અને મુઢ હિંદુઓને હજી સુધી જાગૃતિ આવતી નથી તો પીરાણાપંથીઓ કઇ જાતના હિંદુઓ થવાની આશા સેવી રહ્યા છે? ભાઇશ્રી આ લેખમાં લખેલી પીરાણાપથને લગતી કેટલીક હકીકતો તથા તેને અપાયેલાં વિશેષણો વગેરે જે કાંઇ લખેલાં છે તે સ્વ. નારાણજીભાઇ રામજીભાઇએ લખેલ પુસ્તક નામે "હિંદુધર્મને નામે ચાલતા અર્ધદગ્ધ કબ્રસ્તાની પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ" એ નામે પુસ્તકના આધારે તથા સુરત શહેરમાં ચાલેલ પીરાણા ધર્મ સબંધી કેસની કેટલીક માહીતી મેળવીને લખેલું છે જેની પીરાણાપંથીઓ નોંધ લે.

ભાઇશ્રી મારૂં આ લખાણ તમારા સાથેના મારા કોઇપણ જાતના મતભેદ વગરનું છે તેમજ તમોને હેરાન કરવા કે ઉતારી પાડવા માટે લખેલ નથી. માત્ર તમોને સમજ પાડવા માટે, તમારૂં ધ્યાન દોરવા ખાતર લખેલું છે, જે આ મારા લખાણને તમો હંસરૂપ બની સાર ગ્રહણ કરશો.

realpatidar.com

https://archive.org/details/bk039/page/n18/mode/1up

realpatidar.com

પણ અવળો અર્થ કરશો નહિ. એ મારી નમ્ર વિનંતી છે. ભાઇશ્રી જ્ઞાતિનું હિત એ મારૂં પોતાનું જ હિત છે એ ન્યાયી સૂત્રથીજ લખેલું છે. આશા રાખું છું કે તમારી સાચી મનોભાવના જાહેરમાં જણાવશો. પ્રમાણિક મતભેદ તો દરેકને હોય છે પરંતુ આવા વખતે અંગત મતભેદ રાખી અંગત ગુણદોષનું અવલોકન કરવું એ યોગ્ય ગણાય નહિ.

આ પુસ્તકમાં પૂછેલા પ્રશ્નોના જવાબો તમોને આ પુસ્તક મળ્યા બાદ માસ એકની અંદર અમોને લેખીત જાહેરમાં આપશો. અને જો તેમ તમો નહિ કરો તો અમો સનાતની ભાઇઓ જે પીરાણા સતપંથ ધર્મ ને એક ભેળસેળિયો ન હિંદુ, ન મુસલમાન એવો કબ્રસ્તાની પીરાણા સતપંથ ધર્મ જે સ્વ. નારાણજીભાઇ રામજીએ પોતે લખેલ પીરાણા પોલમાં જેવી રીતે વર્ણવ્યો છે અને તેને જે રીતે અમો માનીએ તેજ રીતે તમો પીરાણા સતપંથી ભાઇઓને પણ કબુલ છે એમ પુરવાર થશે જેની આથી નોંધ લેશો.

લી.

સેવક

પટેલ ગોપાલજી સોમજી ભગત

ગામ કચ્છ શ્રી રવાપરવાળા

તા. ૨૦-૧-૬૮

realpatidar.com

https://archive.org/details/bk039/page/n19/mode/1up

realpatidar.com

— સુધારો —

પાનું	લાઇન	છપાયેલું	સુધારવાનું
૧	૧૬	હાલના	જે હાલના
૧	૨૦	ફેરવમાં	ફેરવતાં
૨	૯	હડહૂત	હડધૂત
૨	૧૪	સામાન	સામાના
૩	૧૧	ધમેંના	ધર્મની
૪	૨૩	સ મે	સામે
૫	૧૧	બાંધો	વાંધો
૬	૨૨	ધન્ય વાદ	ધન્યવાદ
૬	૨૩	પ્રમુખ શ્રીએ	પ્રમુખશ્રીએ
૭	૨૪	અ તે	આ તે
૮	૧૭	હિંદુ પણાનું	હિંદુપણાનું
૯	૧	પીરાણાપંથએો	પીરાણાપંથીઓ
૧૦	૧	પાનાના	પાનામાં
૧૧	૧૫	નહિ	નહિ?
૧૨	૨૬	મુલલમાન	મુસલમાન
૧૨	૨૭	હિંદુઓ ॥	હિંદુઓના

realpatidar.com

https://archive.org/details/bk039/page/n20/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk039/page/n21/mode/1up

realpatidar.com

ક્ષત્રિય તણા સંતાન થઇને આમ શું કાયર થયા ?
કણબી તણા છો કુળદીપક તો આમ શું બુઝાઇ ગયા ? ૧

જાગી જગાવો જ્યોતને તો ઉજાશ અંતરમાં થશે,
ઉજાશના અવકાશથી સઘળું અંધારૂં વહી જશે. ૨

અંધારૂં શાથી થયું જે વિધર્મીઓના પાશથી,
સમજણ પડશે સત્યની એ અંતરના ઉજાશથી. ૩

ભાન થાશે ભુલનું જે હિંદુ મારી જાત છે,
તો હિંદુઓનો ધર્મ સનાતન જે જગતમાં વિખ્યાત છે. ૪

જુઓ ! જગતમાં સનાતન ધર્મનો અધિકાર છે,
તેથી સનાતન ધર્મનો સદાય જય જય કાર છે. ૫

ગોપાલજી સોમજી ભગત

ભારત સરવીસીઝ, ફોર્ટ, મુંબઈ-૧. ફોન : ૨૫૩૪૦૭

realpatidar.com